

Seat No. : \_\_\_\_\_

**AJ-128**

April-2016

B.Com., Sem.-IV

**210 : Fundamental Statistics – II**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

1. (a) આપેલ વિધેયની  $x = a$  આગળ મહત્વ અને લઘુત્તમ કિંમતની વ્યાખ્યા આપો. 4

**અથવા**

માંગની મૂલ્ય સાપેક્ષતા સમજાવો.

- (b) વિધેય  $f(x) = 4x^3 + 3x^2 + 12$  ની મહત્વ અને લઘુત્તમ કિંમત મેળવો. 6

**અથવા**

કોઈ એક વસ્તુનું માંગનું વિધેય  $x = 40 - P$  છે અને ખર્ચનું વિધેય  $C(x) = 6x^2 + 5x + 10$  હોય તો

(i) મહત્વ નફો અને

(ii) મહત્વ નફો માટેની કિંમત મેળવો.

- (c) કોઈ એક વસ્તુનું માંગનું વિધેય  $x = 10 - 2P$  હોય તો  $P = 3$  આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવો. 4

**અથવા**

કોઈ એક વસ્તુનું પુરવઠા વિધેય  $x = 5 + 7P$  હોય તો  $P = 5$  આગળ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા મેળવો.

2. (a) સંકલનની વ્યાખ્યા આપો અને તેના કોઈપણ બે પરિણામ લખો. 4

**અથવા**

નિયત સંકલન સમજાવો અને તેના કોઈપણ બે પરિણામ લખો.

(b) નીચે આપેલા વિધેયોનું સંકલન મેળવો :

6

(i)  $3x + 4x^4 - 5x^3$

(ii)  $e^x + 5^x$

(iii)  $\frac{1}{3x+5}$

અથવા

નીચે આપેલા વિધેયોનું સંકલન મેળવો :

(i)  $4x^3 + 5x^2 - 7x$

(ii)  $(2x + 3)^7$

(iii)  $x + \frac{1}{x} + e^x$

(c) ફિભત મેળવો :

4

(i)  $\int_3^7 \frac{\sqrt{x}}{\sqrt{x} + \sqrt{10-x}} dx$

(ii)  $\int_0^5 x(5-x)^{10} dx$

અથવા

કોઈ એક વस્તુ માટે  $MR = 10 - 2x^2$  હોય તો

(i) કુલ આમદાની વિધેય

(ii) સરેરાશ આમદાની વિધેય અને

(iii) માંગનું વિધેય મેળવો.

3. (a) સુરેખાનો ઢાળ સમજાવો અને તે શૂન્ય હોવા માટેની શરત જણાવો.

4

અથવા

સુરેખાનાં જુદા જુદા સમીકરણો જણાવો.

(b) (i)  $-2/3$  ઢાળવાળી અને  $y$ -અક્ષ પર  $-5$  અંતઃખંડ બનાવતી સુરેખાનું સમીકરણ મેળવો.

(ii) બિંદુ  $(2, 3)$ માંથી પસાર થતી અને સુરેખા  $3x + 4y + 5 = 0$  ને સમાંતર સુરેખાનું સમીકરણ મેળવો.

6

અથવા

- (i) સુરેખાઓ  $3x - 4y + 14 = 0$  અને  $4x + 5y - 33 = 0$  નાં છેદબિંદુ ને  $(-2, -3)$  સાથે જોડતી સુરેખાનું સમીકરણ મેળવો.
- (ii) સુરેખા  $2x + 5y + 9 = 0$  ને લંબ અને બિંદુ  $(4, -5)$ માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવો.
- (c) બિંદુઓ  $(3K - 10, 2K - 3)$  અને  $(3, 6)$ ને જોડતી સુરેખા  $4x - 2y + 9 = 0$  ને સમાંતર હોય તો  $K$ ની કિંમત મેળવો.

4

#### અથવા

બિંદુઓ  $(1, 7)$  અને  $(4, 10)$  ને જોડતી સુરેખા, બિંદુઓ  $(2, 5)$  અને  $(4, 3)$ ને જોડતી સુરેખાને લંબ છે તેમ સાબિત કરો.

4. (a) સમાંતર શ્રેષ્ઠી અને સમગુણોત્તર શ્રેષ્ઠી ઉદાહરણ આપી સમજાવો.

4

#### અથવા

આપેલ બે સંખ્યાઓનાં સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક ઉદાહરણ આપી સમજાવો.

- (b) (i) 200 અને 300 વચ્ચે આવેલી અને 7 વડે નિઃશેષ ભાગી શકતી હોય તેવી સંખ્યાઓનો સરવાળો મેળવો.
- (ii) કોઈ એક સમાંતર શ્રેષ્ઠીનું 10મું પદ 29 અને 16મું પદ સાતમાં પદ કરતાં 27 વધારે હોય તો આ શ્રેષ્ઠીનાં પ્રથમ 20 પદોનો સરવાળો મેળવો.

6

#### અથવા

(i) એક ગુણોત્તર શ્રેષ્ઠીનું 3જું પદ 8 અને 8મું પદ 256 હોય તો તેના પ્રથમ દસ પદોનો સરવાળો મેળવો.

(ii) નીચે આપેલી શ્રેષ્ઠીનાં પ્રથમ  $n$  પદોનો સરવાળો મેળવો :

$$7 + 77 + 777 + 7777 + \dots n \text{ પદ સુધી.}$$

- (c)  $K$ ની કઈ કિંમત માટે  $3K + 5, 7K - 5$  અને  $10K - 10$  સમાંતર શ્રેષ્ઠી બનાવે ?

4

#### અથવા

બે ધન સંખ્યાઓનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 20 અને 12 હોય તો આ બે સંખ્યાઓ મેળવો.

- (1) જે  $y = (2x^2 - 3)^2$  હોય તો  $\frac{d^2y}{dx^2}$  મેળવો.
- (2) જે  $f(x) = 4x^3 + 7x^2 - 3x + 4$  હોય તો  $f''(2)$ ની કિંમત મેળવો.
- (3) AR, MR અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો સંબંધ લખો.
- (4)  $\int \frac{x^2}{x+2} dx$  ની કિંમત મેળવો.
- (5)  $\int_2^5 5x dx$  ની કિંમત મેળવો.
- (6) ઉગમબિંદુમાંથી પસાર થતી અને 4 ટાળવાળી સુરેખાનું સમીકરણ મેળવો.
- (7) આલેખ દોર્યાં વગર સાબિત કરો કે બિંદુ (2, 3) સુરેખા  $4x - 5y + 7 = 0$  પર આવેલું છે.
- (8) સંખ્યાઓ 2 અને 8નાં સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક મેળવો.
- (9) ગુણોત્તર શ્રેષ્ઠીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 35 અને ગુણાકાર 1000 હોય તો આ સંખ્યાઓ મેળવો.
- (10) કોઈ એક શ્રેષ્ઠી માટે  $S_n = n(n + 4)$ હોય તો આ શ્રેષ્ઠીનું nમું પદ મેળવો.
-

**Seat No. :** \_\_\_\_\_

**AJ-128**  
**April-2016**

**B.Com., Sem.-IV**

**210 : Fundamental Statistics – II**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

1. (a) Define maximum and minimum values of a function at  $x = a$ . 4

**OR**

Explain demand elasticity.

- (b) Obtain maximum and minimum values of function  $f(x) = 4x^3 + 3x^2 + 12$ . 6

**OR**

Demand function of a commodity is  $x = 40 - P$  and its cost function is  $C(x) = 6x^2 + 5x + 10$ . Then find

- (i) Maximum profit and  
(ii) Price for maximum profit

- (c) The demand function of a commodity is  $x = 10 - 2P$ , find elasticity of demand at  $P = 3$ . 4

**OR**

The supply function of a commodity is  $x = 5 + 7P$ , find elasticity of supply at  $P = 5$ .

2. (a) Define integration and write any 2 results of it. 4

**OR**

Define definite integration and state any 2 results of it.

- (b) Find integration of following functions : 6
- (i)  $3x + 4x^4 - 5x^3$
  - (ii)  $e^x + 5^x$
  - (iii)  $\frac{1}{3x + 5}$

**OR**

Find integration of following functions :

- (i)  $4x^3 + 5x^2 - 7x$
- (ii)  $(2x + 3)^7$
- (iii)  $x + \frac{1}{x} + e^x.$

- (c) Find the values of 4

- (i) 
$$\int_3^7 \frac{\sqrt{x}}{\sqrt{x} + \sqrt{10-x}} dx$$
- (ii) 
$$\int_0^5 x(5-x)^{10} dx$$

**OR**

For any commodity,  $MR = 10 - 2x^2$ , then find

- (i) Total Revenue Function
- (ii) Average Revenue Function and
- (iii) Demand Function.

3. (a) Explain slope of a straight line and state condition for zero slope. 4

**OR**

State different equations of straight line.

- (b) (i) Find equation of straight line with slope  $-\frac{2}{3}$  and  $-5$  intercept on y-axis. 6
- (ii) Find equation of straight line passes through  $(2, 3)$  and parallel to  $3x + 4y + 5 = 0$ .

**OR**

- (i) Find equation of straight line joining through point of intersection of  $3x - 4y + 14 = 0$  and  $4x + 5y - 33 = 0$  and point  $(-2, -3)$ .
- (ii) Find equation of straight line passes through  $(4, -5)$  and perpendicular to  $2x + 5y + 9 = 0$ .
- (c) Find the value of K, if line joining  $(3K - 10, 2K - 3)$  and  $(3, 6)$  is parallel to the line  $4x - 2y + 9 = 0$ . 4

**OR**

Prove the line joining points  $(1, 7)$  and  $(4, 10)$  is perpendicular to the line joining points  $(2, 5)$  and  $(4, 3)$ .

4. (a) Explain arithmetic progression and geometric progression by giving example. 4

**OR**

Explain arithmetic mean and geometric mean of given two numbers by giving example.

- (b) (i) Find sum of numbers between 200 and 300 which are exactly divisible by 7. 6
- (ii)  $10^{\text{th}}$  term of an A.P. is 29 and its sixteenth term exceeded its seventh term by 27. Find sum of its first 20 terms.

**OR**

- (i) Third term of a G.P. is 8 and  $8^{\text{th}}$  term is 256. Find sum of its first 10 terms.
- (ii) Find sum of first n terms of following series :

$$7 + 77 + 777 + 7777 + \dots \text{ n terms.}$$

- (c) For which value of K,  $3K + 5, 7K - 5$  and  $10K - 10$  will form an A.P. ? 4

**OR**

Find two positive numbers whose arithmetic mean and geometric mean are 20 and 12 respectively.

5. Answer the following : (any **seven**)

**14**

- (1) If  $y = (2x^2 - 3)^2$ , find  $\frac{d^2y}{dx^2}$ .
- (2) If  $f(x) = 4x^3 + 7x^2 - 3x + 4$ , then find the value of  $f''(2)$ .
- (3) State relation between AR, MR and elasticity of demand.
- (4) Find the value of  $\int \frac{x^2}{x+2} dx$ .
- (5) Find the value of  $\int_2^5 5x dx$ .
- (6) Find the equation of straight line passes through origin with slope 4.
- (7) Without drawing graph prove that point (2, 3) is lie on the line  $4x - 5y + 7 = 0$ .
- (8) Find arithmetic and geometric mean of numbers 2 and 8.
- (9) Find three numbers in geometric progression whose sum is 35 and product is 1000.
- (10) For any series  $S_n = n(n + 4)$  find its  $n^{\text{th}}$  term.
-